

U S H A®

શ્રગ બનાવતા શીખો



આ વિડિયોમાં તમે એક સરસ મજાનું ડિઝાઇનર શ્રગ બનાવતા શીખશો.



આ બનાવવા માટે તમને જોઈશે, 67 x 87 સેન્ટિમીટરનો કપડાનો એક ટુકડો. તમે કોઈપણ કાપડ લઈ શકો છો, લેશ વાળું કે ફર વાળું અથવા સિક્વન્સ વાળું અને હંમેશા પ્રમાણે બીડેડ પિન્સ પણ જોઈશે. અને હા એક કપડાનું જ ડેકોરેટિવ ફૂલ પણ જોઈશે.

હવે ફેબ્રિકની ઉંઘી બાજુ ઉપર આવે તેમ રાખો. કાપડની ટૂંકી સાઈડની કિનારને બે ફોલ્ડ કરી, પોણા ઇંચની પટ્ટી વાળો.

જેમ-જેમ તમે વાળતા જાઓ, તેમ-તેમ બીડેડ પિન્સ ખોસતાં જાઓ, જેથી વાળેલી પટ્ટી હલે નહીં. કાપડના બીજા છેડા સુધી આ જ પ્રમાણે કરતા જાઓ. આ જ રીતે કાપડની સામેની કિનાર પણ વાળતા જાઓ. જેમ-જેમ વાળતા જાઓ, તેમ-તેમ વાળેલી પટ્ટી પર પિન્સ લગાવતા જાઓ.

આ રીતે તૈયાર કરેલું કાપડ મશીન પર લાવો અને વાળેલી પટ્ટી અંદરની સાઈડ બરાબર ધાર લઈને સોય નીચે મુકો. કાપડને બરાબર મૂકી પ્રેશર ફુટ નીચે રાખો.

જેમ-જેમ સીવતા જાઓ, તેમ પિન્સ કાઢવાનું ભૂલશો નહીં. આ જ રીતે સામેની કિનાર પણ સીવી લો. ટાંકા બરાબર સીધી લાઈનમાં આવે તેનું ધ્યાન રાખો. હવે કાપડને ટેબલ પર તેની ઉંઘી બાજુ ઉપર આવે તેમ સપાટ પાથરો.

બંને સીવેલા છેડાના કાપડના મધ્યબિંદુએ આવે તેમ વાળો. આ છેડા જોડાઈને બરાબર 90 ડિગ્રીના ખૂણો થાય તેમ વાળવાના છે. આ જ રીતે સામેની કિનાર પણ વાળો.





બહારના કોર્નર પરથી કેન્દ્ર તરફ 17 સેન્ટિમીટર છોડીને માર્કિંગ કરો.
કાપડની ચત્તી બાજુ એકસાથે ઉપાડો, અને તેને પલટાવો.
પિન્સ બોસી આ વાળેલી ઘડી હવે નહીં તેમ પકડો.

આ જ સામેની બાજુએ પણ રિપીટ કરો.

હવે કાપડને મશીન પર લાવો.
અને 17 સેન્ટિમીટરના માર્કથી લઈને બહારની તરફ સીવવા માંડો.
જેમ-જેમ સીવતા જાઓ, તેમ-તેમ પિન્સ કાઢવાનું યાદ રાખો.
સ્ટીચીસ લોક કરવાનું ધ્યાન રાખો.

આ જ પ્રમાણે સામેની બાજુએ પણ સીવો.

હવે સીવેલું કાપડ ટેબલ પર પાથરો.
તમે જોઈ શકશો કે તમે બે છેડાથી 10 સેન્ટિમીટર જેટલું સીવેલું છે.



સિવાયા વગરની કિનાર પર ફિનિશિંગ આપવા સાંધા આગળનો ફોલ્ડ જરા ખોલો, સપાટ કરી પોણા ઇંચનું અલાવન્સ રાખી તે કિનારને ડબલ ફોલ્ડ કરી પટ્ટી વાળો.
આ ફોલ્ડસ ખુલી ના જાય તે માટે બીડેડ પિન્સ વાપરો.

આ રીતે આખા કાપડ ફરતે કરતા જાઓ અને તમે શરુ કર્યું હોય તે જ જગ્યાએ પહોંચશો.
હવે કાપડને મશીન પર પ્રેશર ફુટની નીચે કિનારની લાઇનમાં ગોઠવો.
પ્રેશર ફુટ નીચું કરી સીવવાનું શરુ કરો.

પૂરું થાય ત્યારે સ્ટીચીસ લોક કરો.
કાપડ મશીનમાંથી બહાર કાઢો અને અંદરની બાજુ બહારની તરફ કરો.
તમારું શ્રગ તૈયાર છે.

તમારે તેને જરા વધારે શણગારવું હોય તો એક માસ્ટ મજાનું બ્રોચ પણ લગાવી દો.



જુદા-જુદા કલર્સ અને મટીરીયલ્સ અજમાવી જુઓ, તમારી સર્જકતાને આવવા દો, ખુલવા દો, તમારા બેસ્ટિઝને આ અમૂલ્ય ગિફ્ટ્સ આપી ખુશ કરો!